

ત્વરિત જાહેરાત માટે

એક્શન! બ્રેમ્પટનનો ફિલ્મ ઉદ્યોગ ધમધમી રહ્યો છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 5, 2022) – સીટી ઓફ બ્રેમ્પટનનું ફિલ્મ ઉદ્યોગમાં રેકોર્ડ-બ્રેકિંગ વર્ષ રહ્યું છે. વર્ષ 2021 માં, બ્રેમ્પટનમાં 80 જુદી જુદી ફિલ્મો, ટેલીવિઝન અને કોમર્શિયલ પ્રોડક્શનના આયોજન સાથે કુલ 553 ઉપરાંત દિવસો સુધી ફિલ્મ સંબંધિત પ્રવૃત્તિઓ થઈ, વર્ષ 2020 થી 90 ટકાનો વધારો.

સ્ક્રીન ઉદ્યોગની કંપનીઓ, પ્રોડક્શન અને લોકોએ બનાવેલા અને તેઓ દ્વારા પાલન કરવામાં આવતા કડક COVID-19 આરોગ્ય અને સુરક્ષા પ્રોટોકોલ્સને લીધે, સમગ્ર 2021 મહામારી વર્ષ દરમિયાન પ્રોડક્શન યાલુ રહી શક્યું હતું.

ફિલ્મ પરમીટ મેળવવા અરજી કરતી વખતે, પ્રોડક્શન કંપનીઓએ બ્રેમ્પટનમાં ફિલ્મ અને ટેલિવિઝન ઓફિસને પોતાનો અંદાજિત સીધો ખર્ચ જણાવવો પડે છે. વર્ષ 2018 થી, આ અંદાજો નોંધપાત્ર રીતે વધ્યા છે, અંદાજિત આર્થિક પ્રભાવ 959 ટકા વધીને \$18 મિલિયન ઉપરાંત થયો, અને સીટીની આવક 147 ટકા વધીને 2021 માં \$400,000 આસપાસ થઈ. આ વૃદ્ધિ Netflix (નેટફ્લિક્સ), Apple (એપલ), અને Amazon (એમેઝોન) જેવા વિશાળ US-સ્થિત સ્ટુડિયો પ્રોડક્શનની રૂચિને લીધે આંશિક, તેમજ રૂપાંતરિત સ્ટુડિયો સ્થળ અને હંગામી સ્થાયી સેટ્સના સતત ઉપયોગને લીધે થવાની બાકી હતી.

બ્રેમ્પટનમાં થયેલા તાજેતરના પ્રોજેક્ટ્સમાં સામેલ છે:

- Amazon Prime Video (એમેઝોન પ્રાઇમ વીડિયો)ની નવી સીરિઝ *Reacher* (રીચર)
- Paramount+ (પેરેમાઉન્ટ પ્લસ)ની સીરિઝ *Star Trek: Strange New Worlds* (સ્ટાર ટ્રેક: સ્ટ્રેન્જ ન્યૂ વર્લ્ડ્સ)
- Netflix (નેટફ્લિક્સ)ની ફીચર ફિલ્મ *13: The Musical* (ધી મ્યુઝિકલ) અને *Man from Toronto* (મેન ફ્રોમ ટોરોન્ટો)
- Apple+ (એપલ પ્લસ)ની સીરિઝ, *See* (સી - જુઓ)
- CBC (સી,બી,સી,)ની ટેલિવિઝન સીરિઝ, *Coroner* (કોરોનર)
- અને ઘણાં બધાં પ્રોજેક્ટ્સ!

બ્રેમ્પટન ફિલ્મ નિર્માણ માટે એક આદર્શ સ્થળ છે. સીટી ઓફ બ્રેમ્પટન આ ઉદ્યોગને દ્વારપાલ-શૈલીની સેવાઓ આપવા, ફિલ્મીંગ અને સહાયતા માટે ફિલ્મ-અનુકૂળ સ્થળો શોધી કાઢવા બધાં કદોના નિર્માણને મદદરૂપ થવા કટિબદ્ધ છે, જેમાં સીટીની હરિયાળી પાર્કની જગ્યાઓ અને રમતના મેદાનો, આવાસીય પાડોશ, ઔદ્યોગિક વિસ્તારો, સીટીની સમકાલીન અને વારસારૂપી સગવડો, અને સીન (દૃશ્ય) સેટ કરવામાં મદદરૂપ થવા જુદા જુદા રોડવે વિકલ્પો સામેલ છે. બ્રેમ્પટન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઓફિસ રીજીયન ઓફ પીલ, પીલ રીજીયનલ પોલીસ, સંરક્ષણ સત્તાવાળાઓ અને નિર્માણ જરૂરિયાતો સગવડમય બનાવવા ઘણાં જેવા અન્ય સીટી હિતધારકો સાથે પણ કામ કરે છે.

સીટી ઓફ બ્રેમ્પટન ઓન્ટેરિયો ગ્રીન સ્ક્રીનનું સભ્ય છે, જે સરકાર, ઉદ્યોગ, યુનિયનો, ગિલ્ડ્સ અને વેપાર મંડળો વચ્ચેની પહેલ છે જે વધારે ટકાઉ પરંદગીઓ કરવા પ્રોડક્શન અને સ્ટુડિયોસને સશક્ત બનાવે છે. બ્રેમ્પટન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઓફિસ આટર્સ, કલ્ચર એન્ડ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એજન્સી (ACCIDA) સાથે સીટીમાં ફિલ્મના ભાવિ માટે બ્રેમ્પટન-સ્થિત ફિલ્મ નિર્માતાઓ અને વિષયવસ્તુ સર્જકોને સશક્ત કરવાના માર્ગે ધનિષ્ઠપણે કાર્યરત છે.

બ્રેમ્પટનમાં ફિલ્મીંગ વિશે વધુ જાણવા વેબસાઇટ જુઓ, brampton.ca/film

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન એક રહેવાલાયક સ્થળ છે! આ શહેર રચનાત્મક ઉદ્યોગ, હરિયાળી પહેલો અને તક આપતું કેન્દ્ર છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં આ વૃદ્ધિ અને COVID-19 મહામારી દરમિયાન સીટીને પહેલો આર્થિક પ્રભાવ જોવો એ આપણું સ્થળ, સવલતો અને બ્રેમ્પટનમાં આપણી શ્રેષ્ઠ સેવા અને તકો માટે અપવાદમય અને પ્રમાણ છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“અહીં સીટી ઓફ બ્રેમ્પટનમાં અમલી કર્યું પગલાઓ અને અમારી સમર્પિત ટીમોને આભારી થતા, ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણ ક્ષેત્રોમાં આપણી વૃદ્ધિ મહામારી દરમિયાન ઝડપી રહી હતી. બ્રેમ્પટન તકો આપતું શહેર છે, અને હવે એ રહસ્ય રહ્યું નથી કે બ્રેમ્પટન રચનાત્મક ઉદ્યોગ માટેના નિર્ધારિત સ્થળ તરીકે આંતરરાષ્ટ્રીય મંચ સાથે જોડાયેલું છે.”

- *હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન*

“સીટી ઓફ બ્રેમ્પટનની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઓફિસનું સમર્પણ અને તેઓ દ્વારા અપાતી અપવાદમય સેવાને આભારી થતા, આપણે મહામારી દરમિયાન વિકસિત થઈ શક્યા છીએ અને શહેરમાં ઝડપી આર્થિક વૃદ્ધિ લાવી શક્યા છીએ. આ સફળતા માટે અને ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણની વાત આવે ત્યારે બ્રેમ્પટનને રહેવાલાયક સ્થળ તરીકે વ્યાખ્યાંકિત કરવા બદલ ટીમને અભિનંદન.”

- *પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઈન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca